



ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ

પરિપત્ર : -

વિષય: ખેલ મહાકુભ -૨૦૧૯ ની સ્પર્ધાના રજીસ્ટ્રેશન બાબત

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ અને પી.જી.સેન્ટરના વડાઓને તેમજ ભવનનોના અધ્યક્ષશ્રીઓને ઉપર્યુક્ત વિષય તથા સંદર્ભ પરત્વે જણાવવામાં આવે છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા ખેલ મહાકુભ ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે. ખેલ મહાકુભ-૨૦૧૯ના અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું શાળા/ઝોન, મહાનગરપાલિકા કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે, તો આ અંગેની આપની કોલેજમાંથી ખેલ મહાકુભ-૨૦૧૯માં ભાગ લેનાર ખેલાડીઓને માહિતગાર કરવા તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓને ભાગ લઈ શકે તે અંગેની કાર્યવાહી આપની કક્ષાએથી કરવા જણાવવામાં આવે છે.


I/c કુલસચિવ

નં. : બીકેએનએમયુ/શા.શી/૩૨ /૨૦૧૯-૨૦

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

સરકારી પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડીયા, જૂનાગઢ.

તા.૩૧/૦૭/૨૦૧૯

પ્રતિ,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના આચાર્યશ્રી/ સંચાલકશ્રીઓ/ યુનિવર્સિટી ભવનનોના અધ્યક્ષશ્રીઓ તરફ...

નકલ સાદર રવાના :-

૧. માન.કુલપતિશ્રીના અંગત સચિવશ્રી તરફ...

નકલ સાદર રવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે

૧.કો-ઓર્ડીનેટરશ્રી, ફીઝીકલ એજ્યુકેશન સેલ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ.

૨.આઈ.ટી.સેલ(વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા અર્થે)



રજિસ્ટ્રેશન પ્રક્રિયા



- રજિસ્ટ્રેશનની શરૂઆત : તા.૧૫/૦૭/૨૦૧૯ થી
- www.khel.mahakumbh.org : વેબસાઈટ દ્વારા
- [khel.mahakumbh-2019](#) : એન્ડ્રોઈડ અને આઈ.ઓ.એસ. મોબાઈલ એપ
- શાળા/ગ્રામ્ય કક્ષા : જેતે શાળા દ્વારા
- સીધા જિલ્લા કક્ષા : ડી.એસ.ઓ.ની કચેરીઓ
- સીધા રાજ્ય કક્ષા : ડી.એસ.ઓ.ની કચેરીઓ



ખેલ મહાકુંભ-૨૦૧૯: કેલેન્ડર



ક્રમ	કાર્યક્રમની વિગત	તારીખ (સંભવિત)
૧	રજિસ્ટ્રેશન	તા.૧૫/૦૭/૨૦૧૯ થી ૧૫/૦૮/૨૦૧૯ (૩૦ દિવસ)
૨	શાળા/ગ્રામ્ય કક્ષા સ્પર્ધા	તા.૨૮/૦૮/૨૦૧૯ થી ૩૧/૦૮/૨૦૧૯
૩	તાલુકા કક્ષા સ્પર્ધા	તા.૦૧/૦૯/૨૦૧૯ થી ૦૮/૦૯/૨૦૧૯
૪	જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા	તા.૦૯/૦૯/૨૦૧૯ થી ૨૦/૦૯/૨૦૧૯
૫	રાજ્ય કક્ષા સ્પર્ધા	ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૯

નોંધ:- સ્થાનિક અમલીકરણ સમિતિ દ્વારા સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈ ફેરફાર કરી શકાશે.



રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

(ફોર્મ-અ)

ખેલ મહાકુંભ-૨૦૧૯



વ્યક્તિગત રમત તથા સાંધિક રમત માટેનું પ્રવેશપત્ર (કોઈ પણ એકજ રમતમાં તથા વજન ગ્રુપમાં અને એકજ વયજૂથમાં ભાગ લઈ શકાશે) અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.													
					KMK ID:								
					આધાર ડાયસ નંબર								
૧. શાળા/કોલેજ નું નામ													
૨. વય જુથ (૩૧-૧૨-૨૦૧૯ ની સ્થિતિએ)*													
અં-૯		અં-૧૧		અં-૧૪		અં-૧૭		ઓપન એજ ગ્રુપ		૪૦ થી ઉપર	૬૦ થી ઉપર	ભાઈઓ	બહેનો
૩. રમતનું નામ*													
૪. સબ ઈવેન્ટ*													
૧. ખેલાડીનું નામ*													
૨. જન્મ તારીખ*													
૫. મોબાઇલ નંબર* :													
૬. ઇ-મેઇલ આઇડી													
૭. વાલીનું નામ*													
૮. ઘરનું સરનામું*:													
૯. જિલ્લો/મહાનગરપાલિકા*													
૧૦. જાતિ*													
૧૧. બેન્કની વિગત*													
૧૨. આધાર કાર્ડ નંબર													
૧૩. કોચ/વ્યાયામ શિક્ષકનું નામ													
૧૪. કોચ/વ્યાયામ શિક્ષકનાં ઘરનું સરનામું:													
૧૫. કોચ/વ્યાયામ શિક્ષકની મોબાઇલ નંબર:													
નોંધ : *ચિહ્ન કરેલી વિગતો ભરવી ફરજિયાત છે.													

રજિસ્ટ્રેશન અંગે સુચનાઓ

- અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- ઓપન એજ ગ્રુપ, તથા અભ્યાસ ન કરતા હોય તેવા અને વયજૂથ-૪૦ ઉપરના અને વયજૂથ-૬૦ ઉપરના ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન (૧) શાળા/કોલેજમાં (૨) જિલ્લા રમતગમત અધિકારીની કચેરી (૩) સિનિયર કોચની કચેરી (૪) મોબાઇલ એપ (એન્ડ્રોઇડ અને આઇ.ઓ.એસ.) (૫) વેબપોર્ટલ (www.khelimahakumbh.org) મારફતે કરાવવાનું રહેશે.
- અબવ-૪૦ અને અબવ-૬૦ ના ખેલાડીઓ તેમના વયજૂથની સિવાયની રમતમાં ભાગ લેવા માટે ઓપન એજ ગ્રુપમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એકજ સ્થળેથી કરીશ અન્યથા માત્રુ રજિસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
- હું આથી બાહેધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભ-૨૦૧૯માં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચ અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- વ્યક્તિગત રમતની સબ ઈવેન્ટ માટે પાછળના પૃષ્ઠ પર આપેલ ઈવેન્ટમાં નું નિશાન કરવું.
- વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાંધિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.
- ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબ્લસ અને મિક્સ ડબ્લસ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે.
- જે સ્પર્ધા જિલ્લાકક્ષા/રાજ્યકક્ષાએ સીધી શરૂ થાય છે તેમાં ભાગ લેનાર ખેલાડીઓએ સ્પર્ધા શરૂ થવાના દિન-૭ પહેલાં પોતાના જિલ્લાના જિલ્લા રમત ગમત અધિકારીને પોતાના નામ અને રમતની યાદી જન્મના પુરાવા સાથે રજૂ કરવાની રહેશે.

તા. ___/___/૨૦૧૯

સ્થાન:- _____

ખેલાડીની સહી



રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

ખેલ મહાકુંભ-૨૦૧૯

(ફોર્મ-બ)



સાંધિક રમત માટે ટીમની યાદીનું પ્રવેશ પત્ર
(કોઈ પણ એક જ રમતમાં ભાગ લઈ શકાશે)

૧. ટીમનું નામ/શાળાનું નામ /
કોલેજ/સંસ્થાનું નામ/
ડબ્લસ અને મિક્સ ડબ્લસ
માટેના નામ

પ્રથમ પાર્ટનરનું નામ	બીજા પાર્ટનરનું નામ

૨. રમતનું નામ

૩. સંપર્ક નંબર

૪. ખેલાડીના નામ

અટક	નામ	પિતાનું નામ
૧.		
૨.		
૩.		
૪.		
૫.		
૬.		
૭.		
૮.		
૯.		
૧૦.		
૧૧.		
૧૨.		
૧૩.		
૧૪.		
૧૫.		
૧૬.		

બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એકજ સ્થળેથી કરીશ અન્યથા માત્રું રજિસ્ટ્રેશન રદબાતલ ગણાશે.
- હું _____ આથી બાહેધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભ-૨૦૧૯માં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- દરેક સાંધિક જ રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.

તા. ___/___/૨૦૧૯

સ્થળ:- _____

વેબસાઈટ: www.khelnmahakumbh.org

ખેલાડીની સહી



ખેલમહાકુંભ-૨૦૧૯ (૨મતોની યાદી)



અંક ૨ - ૯ (૧.૧.૨૦૧૧ અને તે પછી જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી.

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૩૦ મીટર સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ

અંક ૨ ૧૧ (૧.૧.૨૦૦૯ થી ૩૧.૧૨.૨૦૧૦ દરમિયાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૫૦ મીટર સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ

સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

ચેસ ચેસ

સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

સ્વીમીંગ ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ

સ્ટેટીંગ ક્લોડ રીક ૧ (૫૦૦ મી.) રીક ૨ (૧૦૦૦ મી.) રોડ ૧ (૧૫૦૦ મી.)
ઈનલાઇન રીક ૩ (૫૦૦ મી.) રીક ૪ (૧૦૦૦ મી.) રોડ ૨ (૫૦૦ મી.) રોડ રેસ ૩ (૧૫૦૦ મી.)

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

સ્વીમીંગ વ્યક્તિગત મીડલે (૨૦૦ મીટર)

અંક ૨ ૧૪ (૧.૧.૨૦૦૬ થી ૩૧.૧૨.૨૦૦૮ દરમિયાન જન્મેલા)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૧૦૦મીટર લાંબીકૂદ ગોળા ફેંક

વોલીબોલ વોલીબોલ

ખો-ખો ખો-ખો

કબડ્ડી ભાઈઓ (૫૧ કિગ્રા) બહેનો (૪૮ કિગ્રા)

સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૨૦૦ મીટર ૪૦૦ મીટર ૬૦૦ મીટર ઉર્ચીકૂદ ચક્રફેંક

ચેસ ચેસ

યોગાસન વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)

સીધી જિલ્લા/કોર્પોરેશનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા

યોગાસન આર્ટિસ્ટિક યોગા(ટ્રેકિશનલ) રિધમીક યોગા

આર્ચરી ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)

સ્વીમીંગ ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ બેક સ્ટ્રોક ૧૦૦ મી બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
 ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.

સ્ટેટીંગ ક્લોડ રીક ૧ (૫૦૦ મી.) રીક ૨ (૧૦૦૦ મી.) રોડ ૧ (૨૦૦૦ મી.)
ઈનલાઇન રીક ૩ (૫૦૦ મી.) રીક ૪ (૧૦૦૦ મી.) રોડ ૨ (૫૦૦ મી.) રોડ રેસ ૩ (૨૦૦૦ મી.)

જુડો ભાઈઓ ૨૫ કિગ્રા સુધી ૨૫-૩૦ કિગ્રા ૩૦-૩૫ કિગ્રા ૩૫-૪૦ કિગ્રા
બહેનો ૨૩ કિગ્રા સુધી ૨૩-૨૭ કિગ્રા ૨૭-૩૨ કિગ્રા ૩૨-૩૬ કિગ્રા

કુસ્તી ભાઈઓ ૩૦-૩૫ કિગ્રા ૩૫-૪૧ કિગ્રા ૪૧-૪૪ કિગ્રા ૪૪-૪૮ કિગ્રા
બહેનો ૨૬-૩૦ કિગ્રા ૩૦-૩૩ કિગ્રા ૩૩-૩૬ કિગ્રા ૩૬-૪૨ કિગ્રા ૪૨-૪૮ કિગ્રા

ટેકવેન્ડો ભાઈઓ ૧૮ કિગ્રા સુધી ૧૮-૨૧ કિગ્રા ૨૩-૨૫ કિગ્રા ૨૭-૨૯ કિગ્રા
બહેનો ૧૬ કિગ્રા સુધી ૧૬-૨૦ કિગ્રા ૨૨-૨૪ કિગ્રા ૨૬-૨૯ કિગ્રા

બેડમીન્ટન સીંગલ્સ

બાસ્કેટબોલ બાસ્કેટબોલ

ટેબલ ટેનીસ સીંગલ્સ

લોન ટેનીસ સીંગલ્સ

હેન્ડબોલ હેન્ડબોલ

હોકી હોકી

કુટબોલ કુટબોલ

કરાટે ભાઈઓ ૨૦ કિગ્રા સુધી ૨૦-૨૫ કિગ્રા ૨૫-૩૦ કિગ્રા ૩૦-૩૫ કિગ્રા ૩૫-૪૦ કિગ્રા ૪૦-૪૫ કિગ્રા ૪૫-૫૦ કિગ્રા ૫૦-૫૫ કિગ્રા ૫૫-૬૦ કિગ્રા ૬૦ કિગ્રાથી ઉપર
બહેનો ૧૮ કિગ્રા સુધી ૧૮-૨૨ કિગ્રા ૨૨-૨૪ કિગ્રા ૨૪-૨૬ કિગ્રા ૨૬-૩૦ કિગ્રા ૩૦-૩૪ કિગ્રા ૩૪-૩૮ કિગ્રા ૩૮-૪૨ કિગ્રા ૪૨-૪૬ કિગ્રા ૪૬-૫૦ કિગ્રા ૫૦ કિગ્રાથી ઉપર

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૮૦ મી હર્ડલ્સ ૪ x ૧૦૦ મી રીલે

સ્વીમીંગ ફ્રી સ્ટાઇલ ૫૦મી ફ્રી સ્ટાઇલ ૨૦૦મી ફ્રી સ્ટાઇલ રીલે ૪x૧૦૦મી બેક સ્ટ્રોક ૫૦ મી બેક સ્ટ્રોક ૨૦૦ મી મીડલે રીલે ૪x૧૦૦મી
 બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦મી બટર ફ્લાય સ્ટ્રોક ૫૦ મી બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી

જુડો ભાઈઓ ૪૦-૪૫ કિગ્રા ૪૫-૫૦ કિગ્રા ૫૦ કિગ્રા થી ઉપર
બહેનો ૩૬-૪૦ કિગ્રા ૪૦-૪૪ કિગ્રા ૪૪ કિગ્રા થી ઉપર

કુસ્તી ભાઈઓ ૪૮-૫૨ કિગ્રા ૫૨-૫૭ કિગ્રા ૫૭-૬૨ કિગ્રા ૬૨-૬૮ કિગ્રા ૬૮-૭૫ કિગ્રા
બહેનો ૪૨-૪૬ કિગ્રા ૪૬-૫૦ કિગ્રા ૫૦-૫૪ કિગ્રા ૫૪-૫૮ કિગ્રા ૫૮-૬૨ કિગ્રા

ટેકવેન્ડો ભાઈઓ ૨૧-૨૩ કિગ્રા ૨૫-૨૭ કિગ્રા ૨૬-૩૨ કિગ્રા ૩૨-૩૫ કિગ્રા ૩૫-૩૮ કિગ્રા ૩૮-૪૧ કિગ્રા ૪૧ કિગ્રાથી ઉપર
બહેનો ૧૬-૧૮ કિગ્રા ૨૦-૨૨ કિગ્રા ૨૪-૨૬ કિગ્રા ૨૬-૩૨ કિગ્રા ૩૨-૩૫ કિગ્રા ૩૫-૩૮ કિગ્રા ૩૮ કિગ્રાથી ઉપર

જીમનાસ્તીક ભાઈઓ ફ્લોર એક્સાઇઝ વોલ્ટીંગ ટેબલ રોમન રીંગ પેરલલ બાર પોમોલોજીસ શેજિજોટલબાર
બહેનો ફ્લોર એક્સાઇઝ વોલ્ટીંગ ટેબલ બેલેસીંગબીમ અનઇવનબાર હૂપ(રિધમીક) ક્લબ(રિધમીક) બોલ(રિધમીક) રોપ(રિધમીક) રીબન (રિધમીક)

આર્ચરી રીકવે રાઉન્ડ વ્યક્તિગત ઓવરશોલ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ ટીમ મીક્સ ટીમ
કમ્પાઉન્ડ રાઉન્ડ વ્યક્તિગત ઓવરશોલ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ ટીમ મીક્સ ટીમ

શુટીંગ ૧૦ મી.એર પીસ્ટોલ ૧૦ મી.પીપ સાઇટ એર સાયફલ ૧૦ મી. ઓપન સાઇટ એર સાયફલ (વ્યક્તિગત)

ટ્રેન્સીંગ કોઇલ ઈપી સેબર

બોક્સીંગ ભાઈઓ ૨૮-૩૦ કિગ્રા ૩૦-૩૨ કિગ્રા ૩૨-૩૪ કિગ્રા ૩૪-૩૬ કિગ્રા ૩૬-૩૮ કિગ્રા ૩૮-૪૦ કિગ્રા ૪૦-૪૨ કિગ્રા ૪૨-૪૪ કિગ્રા ૪૪-૪૬ કિગ્રા ૪૬-૪૮ કિગ્રા ૪૮-૫૦ કિગ્રા
મલાખમ્બ રોપ મલાખમ્બ (ફક્લ બહેનો) પોલ મલાખમ્બ (ફક્લ ભાઈઓ)

સ્પોર્ટ્સ ક્લાઇમીંગ લીડ ક્લાઇમીંગ સ્પીડ ક્લાઇમીંગ બોલરોંગ

રોલ બોલ રોલ બોલ

નોંધ:-યોગાસન માટે,
> ગ્રુપ-A પશ્ચિમોત્તાસન, સર્વોગાસન, મલ્થ્યાસન, અર્ધમસેન્ડ્રાસન, પૂર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન
> ગ્રુપ-B પૂર્ણ ચક્રાસન, કુકરાસન, ભુમાસનપૂર્ણ, સલાભાસન, બકાસન, વિર્ષાસન
> ગ્રુપ-C સાંધ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકરાસન, ઉત્તિશતિભાસન, પદ્મ મયુરાસન, ઉત્તિશાપાદસ્ત્રાસન
- રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમશે

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
> યોગાસનમાં ખેલાડી બાર વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
> બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
> એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
> સ્વીમીંગ રમતમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
> જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્ટેટીંગમાં ક્લોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
> કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
> કુસ્તી, ટેકવેન્ડો, અને જુડોની રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

> જીમનાસ્તીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
> જીમનાસ્તીક સ્પર્ધામાં ૬૬૬ના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

> શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધાએ શુટીંગ માટે પોતાની સાઇફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.



બેલમહાકુલ-૨૦૧૯ (રમતોની યાદી)



અંક ૧૭ (૧.૧.૨૦૦૩ થી ૩૧.૧૨.૨૦૦૫ દરમિયાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ✓ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી.	<input type="checkbox"/> લાંબીફેદ	<input type="checkbox"/> લંગડીજાળ ક્રેડ	<input type="checkbox"/> ગોળાકેક
રસ્સાબેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૪૮૦ કિગ્રા	<input type="checkbox"/> બહેનો ૪૦૦ કિગ્રા	નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)	
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ			
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો			
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૭ કિગ્રા)	<input type="checkbox"/> બહેનો (૫૩ કિગ્રા)		

સીધી તાલુકા/ઝોનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી	<input type="checkbox"/> ૪૦૦મી	<input type="checkbox"/> ૮૦૦ મી	<input type="checkbox"/> ૧૫૦૦ મી.	<input type="checkbox"/> ૫૦૦૦ મી.	<input type="checkbox"/> ૧૦૦૦૦ મી.	<input type="checkbox"/> ૫૦૦૦૦ મી.	<input type="checkbox"/> ચક્રકેક
ચેસ	<input type="checkbox"/> ચેસ							
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસન)							

નોંધ-યોગાસન માટે,
 > ગ્રુપ-A પશ્ચિમોત્તર, સર્વોચ્ચ, મલયાસન, અર્ધમલોચ્ચ, પુર્ણ ધનુરાસન, ઉત્તર પાદાસન
 > ગ્રુપ-B પુર્ણ ચક્રાસન, ક્રુરુશ્ચાસન, શુભાસનપુર્ણ, સલાભાસન, બકાસન, ત્રિશ્ચાસન
 > ગ્રુપ-C સોમ્યાસન, વ્યાયાસન, ઉર્ધ્વ ક્રુરુશ્ચાસન, ઉત્તિચતિવિવાસન, પદ્મ મથુરાસન, ઉત્તિચપાદસ્તાસન
 > રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમાશે.

સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)	
યોગાસન	<input type="checkbox"/> આર્થેસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા	
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફી સ્પાઈલ	<input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી
	<input type="checkbox"/> ૪૦૦ મી.ફી સ્પાઈલ	<input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
સ્કેટીંગ	કવોડ	<input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪(૧૦૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
	ઈનલાઈન	<input type="checkbox"/> રીક ૩(૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪(૧૦૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
જુડો	ભાઈઓ	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૩૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા
કુસ્તી	ભાઈઓ-ફ્રીસ્ટાઇલ	<input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા
	બહેનો-ફ્રીસ્ટાઇલ	<input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૩ કિગ્રા <input type="checkbox"/> ૪૩-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૮ કિગ્રા થી ઉપર
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ	
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ	
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ	
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ	
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ	
હોકી	<input type="checkbox"/> હોકી	
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ	
કરાટે	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.
- > એથલેટીક્સ રમતમાં વધુમાં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ૧૦૦ મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ X ૧૦૦ મી રીલે <input type="checkbox"/> વાંસફેદ <input type="checkbox"/> હથોડા ફેક <input type="checkbox"/> ૫ કી.મી.વોક(ભાઈઓ) <input type="checkbox"/> ૩ કી.મી.વોક(બહેનો)	
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૮૦૦મી (ભાઈઓ)	
	<input type="checkbox"/> વ્યક્તિગત મીડલ ૪૦૦ મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ રીલે ૪ X ૧૦૦ મી <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૫૦ મી	
જુડો	ભાઈઓ	<input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ (ફ્રીસ્ટાઇલ)	<input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૧૧૦ કિગ્રા
	બહેનો (ફ્રીસ્ટાઇલ)	<input type="checkbox"/> ૫૩-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૧-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ	<input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ	<input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલબાર <input type="checkbox"/> પોમોલોસ <input type="checkbox"/> હોરિજોન્ટલબાર
	બહેનો	<input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અનઈવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રોપ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ	
શુટીંગ	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ	
શુટીંગ	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્તોલ <input type="checkbox"/> ૧૦ મી.પીપ સાઈટ એર રાયફલ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઈટ એર રાયફલ (વ્યક્તિગત)	
વેઈટલિફ્ટીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૫૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૬ કિગ્રા <input type="checkbox"/> ૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૯ કિગ્રા <input type="checkbox"/> ૭૭ કિગ્રા <input type="checkbox"/> ૮૫ કિગ્રા <input type="checkbox"/> ૯૩ કિગ્રા <input type="checkbox"/> ૯૪ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૩ કિગ્રા <input type="checkbox"/> ૫૮ કિગ્રા <input type="checkbox"/> ૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯ કિગ્રા થી ઉપર
ટ્રેનિંગ	<input type="checkbox"/> કોઈલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર	
બોક્સીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૪૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ કિગ્રા થી ઉપર
મલખમ	<input type="checkbox"/> રોપ મલખમ (ફક્ત બહેનો) <input type="checkbox"/> પોલ મલખમ (ફક્ત ભાઈઓ)	
સોફ્ટ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ	
સ્પોર્ટ ક્લાઇમીંગ	<input type="checkbox"/> લીડ ક્લાઇમીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લાઇમીંગ <input type="checkbox"/> બોલરોંગ	
રઝબી ફૂટબોલ	<input type="checkbox"/> રઝબી ફૂટબોલ	
શેલ બોલ	<input type="checkbox"/> શેલ બોલ	

- > જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- > જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ડઝાના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

- > શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધાકોષે શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.



ખેલમહાકુંભ-૨૦૧૯ (રમતોની યાદી)



ઓપન એઈજ ગ્રુપ (સિનિયર ગ્રુપ) (૦૧.૦૧.૧૯૮૦ થી ૩૧.૧૨.૨૦૦૨ દરમ્યાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીફૂટ <input type="checkbox"/> લંગડીફાળ ફૂટ <input type="checkbox"/> ગોળાફેંક	નોંધ:- યોગાસન માટે, > ગ્રુપ-૧ પશ્ચિમોત્તરાસન, સર્વાંગાસન, મંચ્યાસન, અર્ધમંચ્યાસન, પુર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન > ગ્રુપ-૨ પુર્ણ ચક્રાસન, કુકુટાસન, ભુમાસનપુર્ણ, સલભાસન, બક્રાસન, શિર્ષાસન > ગ્રુપ-૩ સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિચતિતિવાસન, પદ્મ મધુરાસન, ઉત્તિચપાદક્રમ્યાસન > રાજ્યકક્ષાએ બેસ્ટ એક ધ વેસ્ટ રમશે.
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૫૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૪૦ કિગ્રા	
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ	
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૮૦ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૭૦ કિગ્રા)	
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો	

સીધી તાલુકા / ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

શુટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ઉર્ચીકુદ <input type="checkbox"/> બરછીફેંક <input type="checkbox"/> ચક્રફેંક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)

સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ	નોંધ:- યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.) નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે. > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે. > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં ક્વોટ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે > કુસ્તી, ટેકવેનો, બીક્સીંગ, કરાટે અને જુડો રમતમાં કોઇ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે	
યોગાસન	<input type="checkbox"/> આર્ટિસ્ટિક યોગા (ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા		
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ		
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ		
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ		
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ		
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ		
હોકી	<input type="checkbox"/> હોકી		
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી. ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી. <input type="checkbox"/> ૪૦૦ મી. ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.		
સ્કેટીંગ	કવોડ		<input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઇન લાઇન		<input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૩૦૦૦ મી.)
જુડો	ભાઈઓ		<input type="checkbox"/> ૫૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૩ કિગ્રા
	બહેનો		<input type="checkbox"/> ૪૪ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા
કુસ્તી	ભાઈઓ		<input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો		<input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
ટેકવેનો	ભાઈઓ	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા	
	બહેનો	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા	
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)		
કરાટે	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા	
	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર	

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦૦૦મી <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ <input type="checkbox"/> ૧૦૦ મી. હર્ડલ્સ(બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ x ૪૦૦ મી. રીલે <input type="checkbox"/> વાંસફૂટ <input type="checkbox"/> હથોડા ફેંક	
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ રીલે ૪ x ૧૦૦મી. <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ x ૧૦૦મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી	
	જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર બહેનો <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ	<input type="checkbox"/> ૭૪-૭૯ કિગ્રા <input type="checkbox"/> ૭૯-૮૬ કિગ્રા <input type="checkbox"/> ૮૬-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૭ કિગ્રા <input type="checkbox"/> ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૫૯-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા
ટેકવેનો	ભાઈઓ	<input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨ કિગ્રાથી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩ કિગ્રા થી ઉપર
આર્ચરી	રીકર્વ રાઉન્ડ	<input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
	કમ્પાઉન્ડ રાઉન્ડ	<input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
જીમ્નાસ્ટીક	ભાઈઓ	<input type="checkbox"/> ફ્લોર એક્સાઇલ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોર્સ <input type="checkbox"/> હોરિઝન્ટલબાર
	બહેનો	<input type="checkbox"/> ફ્લોર એક્સાઇલ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અન ઇવનબાર
આર્ટીસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફીગર	> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
સાઇકલરીંગ	<input type="checkbox"/> ૨૦ કી.મી.	
શુટીંગ	રાઇફલ ગ્રુપ	<input type="checkbox"/> ૧૦ મી. પીપ સાઇટ એર શાયફલ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ રાઇફલ ૩ પોજિશન
	પિસ્તોલ ગ્રુપ	<input type="checkbox"/> ૧૦ મી. ૦.૧૭ એર પિસ્તોલ <input type="checkbox"/> ૨૫ મી. ૦.૨૨ રેપીડ ફાયર (ભાઈઓ) <input type="checkbox"/> ૨૫ મી. ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
વેઇટલિફ્ટીંગ	ટ્રેપ ગ્રુપ	<input type="checkbox"/> શોટગન ડબલ ટ્રેપ
	ભાઈઓ	<input type="checkbox"/> ૬૯ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૫ કિગ્રા <input type="checkbox"/> ૯૪કિગ્રા <input type="checkbox"/> ૯૪ કિગ્રાથી ઉપર
ફેન્સીંગ	બહેનો	<input type="checkbox"/> ૫૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯ કિગ્રાથી ઉપર
	ફેન્સીંગ	<input type="checkbox"/> ફોઇલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧ થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧ થી ઉપર
મલાખમ્બ	<input type="checkbox"/> રોપ મલાખમ્બ (ફક્ત બહેનો) <input type="checkbox"/> પોલ મલાખમ્બ (ફક્ત ભાઈઓ)	
સ્પોર્ટ્સ ક્લાઇમ્બીંગ	<input type="checkbox"/> લીડ ક્લાઇમ્બીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લાઇમ્બીંગ <input type="checkbox"/> બોલરોંગ	
રઝમી ફૂટબોલ	<input type="checkbox"/> રઝમી ફૂટબોલ	
સોફ્ટ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ	
વોડે સવારી	<input type="checkbox"/> જમ્પીંગ (ભાઈઓ) <input type="checkbox"/> એન્ડયુરન્સ (ભાઈઓ)	



ખેલમહાકુંભ-૨૦૧૯ (૨મતોની યાદી)



૪૦ વર્ષથી ઉપર (૦૧.૦૧.૧૯૬૦ થી ૩૧.૧૨.૧૯૭૯ દરમ્યાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

રસ્સાખેંચ ભાઈઓ ૫૬૦ કિગ્રા બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)

સીધી તાલુકા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

શુટીંગ બોલ ફક્ત ભાઈઓ માટે

નોંધ:- અબોવ-૪૦ અને અબોવ-૬૦ માટે

ચેસ ચેસ

બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઈવેન્ટમાંથી કોઈ પણ ૨ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

બેડમિન્ટન સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

ટેબલ ટેનીસ સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

લોન ટેનીસ સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

સ્વીમીંગ ૫૦ મી.ફી સ્ટાઈલ ૧૦૦ મી.ફી સ્ટાઈલ ૫૦ મી બેક સ્ટ્રોક

૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦મી.બટર ફ્લાય સ્ટ્રોક

સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૪૦ માં માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે.

➤ આગળ જુકવાનું આસન:- પશ્ચિમોતાસન, ભુમાસન, ઉચિતપાદઆસન, કુર્માસન, યોગાસન

➤ પાછળ જુકવાનું આસન:- ચક્રાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન, ભુંજગાસન, સેતુબંધાઅસન

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

યોગાસન કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ

૬૦ વર્ષથી ઉપર (૩૧.૧૨.૧૯૫૯ અને તે પહેલાં જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

રસ્સાખેંચ ભાઈઓ ૬૨૦ કિગ્રા બહેનો ૪૮૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)

સીધી તાલુકા / ઝોન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા

ચેસ ચેસ

સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

બેડમિન્ટન સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

ટેબલ ટેનીસ સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

લોન ટેનીસ સીંગલ્સ ડબ્લ્સ મિક્સ ડબ્લ્સ

સ્વીમીંગ ૫૦ મી.ફી સ્ટાઈલ ૧૦૦ મી.ફી સ્ટાઈલ ૫૦ મી બેક સ્ટ્રોક

૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી.બટર ફ્લાય સ્ટ્રોક

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૬૦ માં માત્ર એક જ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે. ૫ આસનો કરવાના રહેશે.આગળ જુકવાનું આસન,પાછળ જુકવાનું આસન,કમળને વળાંક આપતું

સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

યોગાસન કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ